

એમ્ફેટામાઈન્સ

વિશેની હકીકતો

The facts about Amphetamines

FRANK

0800 77 66 00

આ નંબર ઉપર તમારી ભાષામાં
વાત કરી શક્તાં લોકો મળી શકશે.

www.talktofrank.com

DrugScope

020 7928 1211

www.drugscope.org.uk

For additional copies, please
contact Prolog on 0870 2414680

Produced by the FRANK campaign in association
with DrugScope and funded by the Home Office.

BMECOMSG4

Gujarati

એમ્ફેટામાઈન્સથી લોકોને શું થાય છે?

તે લોકોને વધારે ચેતન અને આત્મવિશ્વાસ આપે છે.
તે લોકોની ભૂખને મારી નાખે છે. કેટલાંક લોકો વજન ઉતારવામાં મદદ માટે એમ્ફેટામાઈન્સનો ઉપયોગ કરે છે.

એમ્ફેટામાઈન્સથી વ્યક્તિને:

- કારણ વગર ચિંતા થઈ શકે છે;
- દરેક જણ પોતાની વિરુદ્ધ છે એવું લાગી શકે છે;
- ઊંઘ આવતી નથી;
- તે ડ્રગ લીધા વગર દિવસ પસાર કરી શકાતો નથી.

એમ્ફેટામાઈન્સથી આ પણ થઈ શકે છે:

- હાર્ટ એટેક;
- હૃદયની બીજી તકલીફો;
- જો તે ઈન્જેક્શનથી લેવામાં આવે તો લોહીમાં ઝેર ફેલાવું, એચઆઈવી/એઈડ્સ અને હેપેટાઈટીસ.

એમ્ફેટામાઈન્સ કેવી દેખાય છે?

તે સફેદ, આછા રાખોડી, ગુલાબી કે પીળા રંગનો પાવડર હોય છે.

લોકો એમ્ફેટામાઈન્સ કેવી રીતે લે છે?

નાક વાટે સૂંઘીને તે લઈ શકાય છે; સિગરેટના કાગળમાં વીંટાળીને ગળી જઈ શકાય છે; સોય અને સીરિંજ વડે ઈન્જેક્ટ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ એમ્ફેટામાઈન્સ ઈન્જેક્શન વાટે લેતી હોય, તો તેનો 'ઓવરડોઝ' થવાની (તે બહુ વધારે પડતી લઈ લેવાની) શક્યતા વધે છે.

એમ્ફેટામાઈન્સનાં બીજાં નામો

તે 'સ્પીડ', 'વિહ્વલ', 'બિલિ' અને 'સલ્ફ'ના નામથી પણ ઓળખાય છે.

એમ્ફેટામાઈન્સની કિંમત કેટલી હોય છે?

એક નાની બેગ £5 ની હોય છે.

તે કાનૂની છે?

ના. તમારી પાસે (દાખલા તરીકે તમારા ખિસ્સામાં) કે તમારા ઘરમાં એમ્ફેટામાઈન્સ હોવાનું કાયદા વિરુદ્ધ છે. એમ્ફેટામાઈન્સ કોઈને વેચવાનું કે કોઈને એટલે કે મિત્રોને પણ આપવાનું ગેરકાનૂની છે.

What do amphetamines do to people?

They give people more energy and confidence. They stop people from feeling hungry. Some people use amphetamines to help them lose weight.

Amphetamines can make a person:

- worried for no reason;
- think everyone is against them;
- unable to sleep;
- unable to get through the day without the drug.

Amphetamines can also cause:

- heart attacks;
- other heart problems;
- blood poisoning, HIV/AIDS and hepatitis if they are injected.

What do amphetamines look like?

They are a white, light grey, pink or yellow powder.

How do people take amphetamines?

They can be sniffed up the nose; swallowed wrapped up in cigarette papers; injected with a needle and syringe. If a person injects amphetamines, they are more likely to 'overdose' (take too much).

Other names for amphetamines

They are also called speed, whiz, billy and sulph.

How much do amphetamines cost?

They cost £5 for a small bag.

Are they legal?

No. It is against the law to have amphetamines on you (for example, in your pockets) or in your house. It is also illegal to sell or give amphetamines to anyone, even friends.